

External Affairs Minister's bilateral engagements on the sidelines of the Special ASEAN-India Foreign Ministers' Meeting

17 June, 2022

વિશેષ ASEAN-ભારતનાં વિદેશ મંત્રીઓની મીટિંગનાં આવકાશમાં વિદેશ મંત્રીની દ્વિપક્ષીય સંલગ્નતાઓ

17 જૂન, 2022

વિશેષ ASEAN-ભારતનાં વિદેશ મંત્રીઓની મીટિંગનાં અવકાશમાં, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર દ્વારા બ્રુનેઇ, ઈન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામનાં તેઓનાં સમતુલ્યો સાથે શ્રેણીબદ્ધ દ્વિપક્ષીય સામેલગીરીઓ યોજવામાં આવી હતી.

2. બ્રુનેઇનાં વિદેશ મંત્રી ડાટો એરીવાન પેલિન યુસોફ સાથેની 16 જૂનની તેઓની મુલાકાતમાં બન્ને મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેઓ સંમત થયા હતા કે વ્યાપાર અને રોકાણ, હાઈડ્રોકાર્બન અને પેટ્રોલિયમ, અવકાશ, કૃષિ અને ફાર્માસ્યુટિકલ્સનાં ક્ષેત્રોમાં સહકાર વધારે મજબૂત બનાવવો જોઈએ.

3. ઈન્ડોનેશિયાનાં વિદેશ મંત્રી મહામહિમ શ્રીમતિ રેન્નો માર્સુડી સાથે ભારતનાં વિદેશ મંત્રીએ 17 જૂન 2022 નાં રોજ 7મી સંયુક્ત કમિશનની મીટિંગ યોજી હતી. બન્ને મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી અને ભારત-ઈન્ડોનેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધારે મજબૂત બનાવવાનાં આગળનાં માર્ગોની ચર્ચા કરી હતી. મંત્રીઓએ “રાજદ્વારી અને અધિકૃત/સેવા પાસપોર્ટ ધારકો માટે વિઝાની આવશ્યકતા માંથી મૂક્તિ પર સમજૂતિ” પર હસ્તાક્ષર કર્યા હતા. તેઓ “તેઓ નાર્કોટિક ડ્રગ્સ, સાયકોટ્રોપિક પદાર્થો અને તેઓનાં પૂર્વવર્તીઓમાં ગેરકાનૂની ટ્રાફિકિંગનો સામનો કરવા પર ભારતનાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) અને ઈન્ડોનેશિયાનાં નેશનલ નાર્કોટિક્સ બોર્ડ વચ્ચે એમઓયૂ” અને “નેશનલ સુગર ઈન્સ્ટિટ્યુટ, કાનપુર અને પોલિટેકનિક પેકેબુનાન, એલપીપી, યોગ્યાકાર્તા વચ્ચે એમઓયૂ” નાં આદાનપ્રદાનનાં સાક્ષી પણ બન્યા હતા. બન્ને મંત્રીઓએ ઈન્ડો-પેસિફિક સહિત આંતરરાષ્ટ્રીય અને પ્રાંતિય મુદ્દાઓ પર ટ્રશિકોણોની આપ-લે કરી હતી. 20 દેશોની તેની અધ્યક્ષતા માટે વિદેશ મંત્રીએ ઈન્ડોનેશિયા સાથે અખંડિતતા વ્યક્ત કરી હતી અને તેની પ્રાથમિકતાઓને સમર્થન આપ્યું હતું.

4. ભારતનાં વિદેશ મંત્રી 17 જૂનનાં રોજ મલેશિયાનાં વિદેશ મંત્રી શ્રી દાતો સૈકુદિન અબ્દુલ્લાહને પણ મળ્યા હતા અને કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રોની પરસ્પર ઓળખ કરવા માટેની નોંધનાં આદાનપ્રદાનનાં સાક્ષી બન્યા હતા. બન્ને મંત્રીઓએ પામ ઓઈલ અને હાઈડ્રોકાર્બન સહિતનાં ક્ષેત્રો સહિત આર્થિક અને વ્યાપારનાં જોડાણોમાં ધ્યાન કેન્દ્રિત કરવા સાથે સંબંધોમાં નવો વેગ લાવવાનું નક્કી કર્યું હતું. તેઓ મલેશિયામાં આગામી સંયુક્ત કમિશનની મીટિંગ યોજવા સંમત થયા હતા. તેઓએ પ્રાંતિય અને વૈશ્વિક વિકાસો પર ટ્રશિકોણોની આપ-લે પણ કરી હતી.

5. સિંગાપોરનાં વિદેશ મંત્રી મહામહિમ ડૉ. વિવિયન બાલાક્રિષ્નન 15 જૂનનાં રોજ ભારતનાં વિદેશ મંત્રીને

મળ્યા હતા અને વ્યાપાર અને રોકાણ, ડિજિટલ ઈકોનોમી અને ક્લિનટેક, ગ્રીન ગ્રોથ અને વિકાસ, અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રો સહિત બન્ને દેશો વચ્ચે બહુઆયામી સંબંધોનાં વિવિધ પાસાઓની ચર્ચા કરી હતી. તેઓએ વૈશ્વિક ભૂરાજકીય પરકારો અને પ્રાંતમા વિકાસો પર વિષદ વાતચીત પણ કરી હતી. બન્ને મંત્રીઓ વધારે મંત્રી સ્તરનાં જોડાણો મારફત સંબંધોને વૃદ્ધિ માટે નવો વેગ આપવાની જરૂરીયાત પર સંમત થયા હતા.

6. ભારતનાં વિદેશ મંત્રી 16 જૂનનાં રોજ થાઈલેન્ડનાં ઉપ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શ્રીમતિ પોર્નપિમોલ કાંચાનાલાકનાં વિશે, કાફલાને પણ મળ્યા હતા. વિદેશ મંત્રીએ તેણીને BIMSTEC ની થિલેન્ડની અધ્યક્ષતા દરમિયાન ભારતનાં સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.

7. ભારતનાં વિદેશ મંત્રી અને વિયેતનામનાં વિદેશ મંત્રી મહામહિમ બુઈ થાન્હ દ્વારા 17 જૂનનાં રોજ દ્વિવપક્ષીય મીટિંગ યોજવામાં આવી હતી અને રાજદ્વારી સંબંધોનાં 50 વર્ષની ઉજવણી માટે લોગો પણ લોન્ચ કર્યો હતો. આ મીટિંગ વિયેતનામની એમ્બેસીની નવી સદર અદાલતનાં ભવનમાં યોજવામાં આવી હતી. મંત્રીઓએ દ્વિવપક્ષીય મુદ્દાઓ, અને પારસ્પરિક હિતનાં પ્રાંતિય અને આંતરરાષ્ટ્રીય વિકાસોની વ્યાપક શ્રેણીમાં ચર્ચા કરી હતી. તેઓએ ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનોની પણ ચર્ચા કરી હતી, આ મીટિંગ બાદ, ભારતનાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન મંત્રાલયનાં CERT-ભારત અને વિયેતનામનાં ઈન્ફર્મેશન અને કમ્યૂનિકેશન મંત્રાલયનાં VNCERT વચ્ચે સાયબર સુરક્ષા પર એમઓયૂની આપ-લે કરવામાં આવી હતી.

નવી દિલ્હી

17 જૂન, 2022

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.